



Re-Accredited 'B++' 2.86 CGPA by NAAC

**VEER NARMAD SOUTH GUJARAT UNIVERSITY**

University Campus, Udhna-Magdalla Road, SURAT - 395 007, Gujarat, India.

**વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી**

યુનિવર્સિટી કેમ્પસ, ઉદ્ધના-મગદલ્લા રોડ, સુરત - ૩૯૫ ૦૦૭, ગુજરાત, ભારત.

Tel: +91 - 261 - 2227141 to 2227146, Toll Free : 1800 2333 011, Digital Helpline No.- 0261 2388888

E-mail : info@vnsgu.ac.in, Website : www.vnsgu.ac.in


## **:- પરિપત્ર :-**

યુનિવર્સિટી સંલગ્ન વિનયન વિદ્યાશાખા હેઠળની તમામ કોલેજોનાં આચાર્યશ્રીઓને જણાવવાનું કે, શૈક્ષણિક વર્ષ ૨૦૨૫-૨૬ થી સમાજશાસ્ત્ર વિષયમાં પ્રથમ વર્ષ બાદ Exit થનાર વિદ્યાર્થીઓ માટે Vocational Exit Course For Certificate અને દ્વિતીય વર્ષ બાદ Exit થનાર વિદ્યાર્થીઓ માટે Diploma Course નો અભ્યાસક્રમ સમાજશાસ્ત્ર વિષયની અભ્યાસ સમિતિની તા.૨૧/૦૧/૨૦૨૫ ની સભાનાં ઠરાવ ક્રમાંક:૩ થી અભ્યાસક્રમ નીમેલ પેટાસમિતિ દ્વારા તૈયાર કરવામાં આવેલ અભ્યાસક્રમ ચેરમેનશ્રીએ અભ્યાસ સમિતિ વતી મંજૂર કરી વિનયન વિદ્યાશાખાને કરેલ ભલામણ સ્વીકારી વિનયન વિદ્યાશાખાની તા.૨૮/૦૪/૨૦૨૫ની સભાનાં ઠરાવ ક્રમાંક: ૧૨ થી કરેલ ભલામણ સ્વીકારી એકેડેમિક કાઉન્સિલની તા.૦૫/૦૫/૨૦૨૫ ની સભાનાં ઠરાવ ક્રમાંક: ૪૯ થી મંજૂર કરેલ છે. જેનો અમલ કરવા આથી જાણ કરવામાં આવે છે.

બિડાણ: ઉપર મુજબ

ક્રમાંક:ઓથો./પરિપત્ર/૧૧૮૩૪/૨૦૨૫

તા.૧૫-૦૫-૨૦૨૫

  
કુલસચિવ (સા)

પ્રતિ,

૧) યુનિવર્સિટી સંલગ્ન વિનયન વિદ્યાશાખા હેઠળની તમામ કોલેજોનાં આચાર્યશ્રીઓ.

.....આપશ્રીની કોલેજના સંબંધિત શિક્ષકોને જાણ કરી અમલ કરવા સારું.

૨) ડીનશ્રી, વિનયન વિદ્યાશાખા.

૩) પરીક્ષા નિયામકશ્રી, પરીક્ષા વિભાગ, વીર નર્મદ દ. ગુ. યુનિવર્સિટી, સુરત.

.....તરફ જાણ તેમજ અમલ સારું.

011.12  
1721.2

# F.Y.B.A. VOCATIONAL EXIST COURSE

BK Bhandari

**VEER NARMAD SOUTH GUJARAT UNIVERSITY, SURAT**  
**UNDERGRADUATE PROGRAMME IN SOCIOLOGY**  
**F.Y. B.A. VOCATIONAL EXIT COURSE**  
**SOCIOLOGY – VAC**

**Course Title: Basics of Urban Sociology**

<b>Course Code</b>	SOCIO-EXIT-VOCATIONAL COURSE								
<b>Course Title</b>	Basics of Urban Sociology								
<b>Course Level</b>	-----								
<b>Credit</b>	04 Credit (4*15=60 Hours)								
<b>Total Teaching Hours</b>	60 Hours								
<b>Lecture/Week</b>	04 Lectures per Week								
<b>Minimum Weeks/Semester</b>	15 Weeks (Including Lectures; Examinations; Preparations; Holidays etc.)								
<b>Effective From</b>	2025-26								
<b>Purpose of Course / Course of Objective</b>	CO1: To provide a conceptual understanding of urban, urbanism, and urbanization. CO2: Equip with various aspects of urban sociology such as history, factors, impacts, planning, management, and significance of urban sociology. CO3: To explain to students the sociological contribution, issues, and problems of urban society.								
<b>Course Learning Outcomes</b>	PSO1: Students will be able to understand urban society's significance, history, factors, trends, and conceptual clarity. PSO2: Able to see urban society from a sociological lens and become aware of urban management, the history of urban planning, and factors affecting planning. PSO3: Get familiar with basic concepts, urban planning, governance, problems and issues of urban sociology,								
<b>Course Mapping COs with PSOs</b>		PSO1	PSO2	PSO3	PSO4	PSO5	PSO6	PSO7	PSO8
	CO1								
	CO2								
	CO3								
<b>SYLLABUS</b>									
<b>UNIT – I</b>	<b>Urban Sociology: An Introduction.</b>							<b>Contact Hrs. 14</b>	
	Basic Concepts: Urban, Urbanism and Urbanization Trends in Urban Growth: City; Town; Mega Cities; Metropolis; Megalopolis Urbanism as a Way of Life: Wirth Louis								
<b>UNIT – II</b>	<b>Urban Sociology in India:</b>							<b>Contact Hrs. 16</b>	
	Development of Urban Sociology in India Factors of Urbanization; Impacts of Urbanization								

*B.B. Bhandari*

	Sociological Contribution: Patric Geddes; MSA Rao and Harish Doshi	
<b>UNIT – III</b>	<b>Urban Planning and Governance</b>	<b>Contact Hrs. 16</b>
	Urban Planning: Meaning, Concept and Characteristics; History of Urban Planning in India; Urban Management in India; Factors Affecting Planning.	
<b>UNIT – IV</b>	<b>Urban Problems and Issues:</b>	<b>Contact Hrs. 16</b>
	Housing; Slums; Water Crisis; Pollutions.	
<b>REFERENCES</b>		
<b>NOTE: (Other latest readings will be referred to as required.)</b>		

1.	Acharya Hemlata, 1956, 'Urbanizing Role of an Onelakh City' in Sociological Bulletin, V. September.
2.	Baali . and Vandiver J.S. (Ed.) 1970, 'Urban Sociology' New York.
3.	Berger E.E. 1955. 'Urban Sociology': McGraw Hill Boook New York
4.	Desai A.R. 1978 'Urban Family in India'
5.	----- 1985. Trends of Urban Development and Proliferation of Slums and Squatting: C.G.Shah Memorial Trust Publication Bombay.
6.	Doshi Harish, 1974. Untouchability in an Urban Community ICCSR New Delhi.
7.	----- 1977. Traditional Neighborhood in Modern City, New Delhi.
8.	Erickson 1954 'Urban Sociology' Chicago Press
9.	Ghurye G.S. 1962. 'Cities and Civilization' Popular Bombay
10.	Hunter David R.1964. 'The Slums: Challenge and Response'. New York Press
11.	Manu Peter H. 1968. An Approach to Urban Sociology. New York.
12.	Mellor J.R. 1977. Urban Sociology in an Urbanized Society.
13.	Srinivas M.N. 1974. 'The Industrialization and Urbanization' in MSA Rao's Urban Sociology
14.	-----1966. Social Change in Modern India.
15.	દેસાઈ એ.આર. અને નીરા દેસાઈ ૧૯૬૭. વિકસતા શહેરો અને ગુપ્તપટ્ટીઓ' આર આર શેઠ બોમ્બે.
16.	દેસાઈ એ.આર અને નીરા દેસાઈ ૧૯૬૭ ભારતીય નગર. બોમ્બે
17.	હરીશ દોશી (એચ.એલ.દોશી) ૧૯૮૦. નગર સમાજશાસ્ત્ર, ગ્રંથ નિર્માણ બોર્ડ, ગુજરાત રાજ્ય. પ્રથમ આવૃત્તિ
18.	હરીશ દોશી (એચ.એલ.દોશી) ૧૯૮૦. નગર સમાજશાસ્ત્ર, ગ્રંથ નિર્માણ બોર્ડ, ગુજરાત રાજ્ય. બીજી આવૃત્તિ
19.	હરીશ દોશી (એચ.એલ.દોશી) ૧૯૮૮. નગર સમાજશાસ્ત્ર, ગ્રંથ નિર્માણ બોર્ડ, ગુજરાત રાજ્ય. ત્રીજી આવૃત્તિ
20.	હરીશ દોશી (એચ.એલ.દોશી) ૧૯૮૯ ભારતમાં નગરીકરણ.

<b>E-Learning</b>	E-PG-Pathshala – Video and Written Content (UGC Sponsored Platform)
	Swayam Portal ( <a href="https://Swavam.gov.in">https://Swavam.gov.in</a> ) UGC Sponsored Platform
	CEC Platform ( <a href="https://cec.nic.in/cec/">https://cec.nic.in/cec/</a> )
<b>Teaching Methods</b>	The Lecture, Blackboard, Group Discussion, Oral Presentation; Quiz, PPT, Audio-Visual Medium, and Assignment are used.
<b>Evaluation Methods</b>	50% CCE (Continuous and Comprehensive Evaluation) – Formative and 50% SEE (Semester End Evaluation) Summative.

*BBB*

**S.Y.B.A. VOCATIONAL EXIST COURSE**

*B.B. Bendre*

**VEER NARMAD SOUTH GUJARAT UNIVERSITY, SURAT**

**UNDERGRADUATE PROGRAMME IN SOCIOLOGY**

**S.Y. B.A. VOCATIONAL EXIT COURSE**

**SOCIOLOGY – VAC**

**Course Title: Sociology of Tribal Tourism**

<b>Course Code</b>	SOCIO-EXIT-VOCATIONAL COURSE								
<b>Course Title</b>	Sociology of Tribal Tourism								
<b>Course Level</b>	-----								
<b>Credit</b>	04 Credit (4*15=60 Hours)								
<b>Total Teaching Hours</b>	60 Hours								
<b>Lecture/Week</b>	04 Lectures per Week								
<b>Minimum Weeks/Semester</b>	15 Weeks (Including Lectures; Examinations; Preparations; Holidays etc.)								
<b>Implementation Years</b>	2025-26								
<b>Purpose of Course / Course of Objective</b>	<p>CO1: To provide an understanding of the Sociology of Tribal Tourism and to equip with various dimensions of the tourism industry.</p> <p>CO2: To explain tourism's socio-cultural and economic impacts on host tribals.</p> <p>CO3: To help students enter the field of tribal tourism and generate employment opportunities.</p>								
<b>Course Learning Outcomes</b>	<p>PSO1: Students will be able to understand the significance and scope of tribal tourism culture.</p> <p>PSO2: Able to see tribal tourism from a sociological lens and become aware of occupational scope in the tribal tourism industry.</p> <p>PSO3: Get familiar with regional tourism policy, places and markets.</p>								
<b>Course Mapping COs with PSOs</b>		PSO1	PSO2	PSO3	PSO4	PSO5	PSO6	PSO7	PSO8
	CO1								
	CO2								
	CO3								
<b>SYLLABUS</b>									
<b>UNIT – I</b>	<b>Tribal Tourism: An Introduction.</b>							<b>Contact Hrs. 14</b>	
	<p>Concept of Tour, Tourist, and Tourism.</p> <p>Meaning, Concept, and Characteristics of Sociology of Tribal Tourism.</p> <p>History and Development of Tourism in India.</p> <p>Significance of Tribal Tourism.</p>								
<b>UNIT – II</b>	<b>Methodology and Impacts: Tribal Tourism</b>							<b>Contact Hrs. 16</b>	
	Typology of Tribal Tourism								

*B.B. Bendre*

	Sociological Perspectives: Sustainable Development; Socio-Economic and Environmental. Impacts of Tribal Tourism: Socio-Cultural; Economic and Environmental. Tribal Tourism as an Industry.	
<b>UNIT – III</b>	<b>Tribal Tourism in Gujarat</b>	<b>Contact Hrs. 16</b>
	Tourism Policy of Gujarat. Schemes of Tourism in Gujarat. Regional Institutes of Tourism Studies. Tribal Tourism Potentials and Strengths.	
<b>UNIT – IV</b>	<b>Tourism, Market and Hospitality in Gujarat</b>	<b>Contact Hrs. 16</b>
	Tribal Tourist Places and Market. Major Tribal Tourist Facilities: Accommodation; Transportation; Hospitality and Food. Role of ICT in Tribal Tourism. Employment Opportunities.	
<b>REFERENCES</b>		
<b>NOTE: (Other latest readings will be referred to as required.)</b>		

1.	Brahmankan, E.B., (1998) Travel and Tourism as a Career, Vol.37,.11.
2.	Chib, S.N., (1981) Perspectives on Indian Tourism-I, Vol.77,.19-11, Vol.77,20.
3.	Chile, Som, N., (1981) Perspectives of Tourism in India, Sardar Patel Memorial Lectures, Publications Division, Government of India.
4.	Cohen, Erik (1984) The Sociology of Tourism: Approaches, Issues, and Findings, Annual Review of Sociology 10:373-392.
5.	Selvafri, M., (1989) Tourism Industry in India, Bombay. Himalayan Publishing House.
6.	Study Report by Dalal Mott, Perspective Plan for Development, Joint Director of Gujarat (MR), Department of Tourism, New Delhi.
7.	Gujarat Tourism Policy, 2021-2025, published by Gujarat Tourism.
8.	Tourism and Hospitality: Concept, Component, Status and Trends, MHRD, E-PG Pathshala, Paper I, Module-III, Govt. of India.
9.	Tourism in India: Significance of Tourism in India, MHRD, E-PG Pathshala, Govt. of India.
10.	Tourism in India: Forms of Tourism, MHRD, E-PG Pathshala, Govt. of India.
11.	Tourism in India: Impacts of Tourism, MHRD, E-PG Pathshala, Govt. of India.
12.	Tourism in India: Tribes and Tourism, MHRD, E-PG Pathshala, Govt. of India.
13.	ઇતિહાસમાં પ્રવાસન વિનિયોગ, ડૉ. કોરાટ અને મહેબૂબ દેસાઈ, 2004
14.	પ્રવાસન ઉદ્યોગ, ડૉ. એમ એલ. પઢિયાર. IGNOU
15.	પ્રવાસન -સિદ્ધાંત અને વ્યવહાર, મહેબૂબ દેસાઈ, ગુજર પ્રકાશન અમદાવાદ
16.	રાવલ ચંદ્રિકા અને ધ્રુવ શૈલજા (૨૦૨૧) “પ્રવાસનનું સમાજશાસ્ત્ર” પાર્શ્વ પ્રકાશન, અમદાવાદ.
17.	ઠાકર મીનાક્ષી (2006) પ્રવાસ ભૂમિ ગુજરાત, નવ ભારત સાહિત્ય મંદિર, મુંબઈ.
18.	અંજના શાહ (2003) પ્રવાસન ઉદ્યોગના મૂળભૂત ઘટકો, ભાવનગર યુનિવર્સિટી.
19.	<a href="http://www.ijcrar.com/vol-1/T.Arunmozhi%20and%20A.%20Panneerselvam.pdf">http://www.ijcrar.com/vol-1/T.Arunmozhi%20and%20A.%20Panneerselvam.pdf</a>
20.	<a href="https://gujaratindia.gov.in/about-gujarat/gujarat-tourism.htm">https://gujaratindia.gov.in/about-gujarat/gujarat-tourism.htm</a>
21.	<a href="https://www.gujarattourism.com/content/dam/gujarattourism/images/document/Tourism%20Policy.pdf">https://www.gujarattourism.com/content/dam/gujarattourism/images/document/Tourism%20Policy.pdf</a>
22.	<a href="https://www.grihaindia.org/sites/default/files/pdf/Griha-incentives/Gujarat-tourism-policy.pdf">https://www.grihaindia.org/sites/default/files/pdf/Griha-incentives/Gujarat-tourism-policy.pdf</a>
23.	<a href="https://gujaratindia.gov.in/index.htm">https://gujaratindia.gov.in/index.htm</a>
24.	<a href="https://tourism.gujarat.gov.in/home">https://tourism.gujarat.gov.in/home</a>
25.	<a href="https://www.grihaindia.org/sites/default/files/pdf/Griha-incentives/Gujarat-tourism-policy.pdf">https://www.grihaindia.org/sites/default/files/pdf/Griha-incentives/Gujarat-tourism-policy.pdf</a>
26.	Brahmankan, E.B., (1998) Travel and Tourism as a Career, Vol.37,.11.

*B.B. Bhandari*

27. Chib, S.N., (1981) Perspectives on Indian Tourism-I, Vol.77,.19-11, Vol.77,20.

<b>E-Learning</b>	E-PG-Pathshala – Video and Written Content (UGC Sponsored Platform)
	Swayam Portal ( <a href="https://Swayam.gov.in">https://Swayam.gov.in</a> ) UGC Sponsored Platform
	CEC Platform ( <a href="https://cec.nic.in/cec/">https://cec.nic.in/cec/</a> )
<b>Teaching Methods</b>	The Lecture, Blackboard, Group Discussion, Oral Presentation; Quiz, PPT, Audio-Visual Medium, and Assignment are used.
<b>Evaluation Methods</b>	50% CCE (Continuous and Comprehensive Evaluation) – Formative and 50% SEE (Semester End Evaluation) Summative.

*B. B. Bendre*